



DISTRICT SPORTS COACHING CENTRE, MORBI.



A SUB OFFICE OF
SPORTS AUTHORITY OF GUJARAT
 Dept. of Sports Youth & Cultural Activities Govt. of Gujarat



Ref. No./D.S.C.C./: ખેમકું/૨૦૨૬-૨૭/૪૨

Date : ૩૧/૦૮/૨૦૨૬

પ્રતિ,
 આચાર્યશ્રી,
 પ્રાથમિક, માધ્યમિક, ઉ. માધ્યમિક શાળાઓ તમામ,
 મોરબી શહેર.

વિષય : ખેલ મહાકુંભ ૨૦૨૬ અંતર્ગત ખેલાડીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા બાબત.

સંદર્ભ : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પરિપત્રના ક્રમાંક એસ.એ.જી./ખેમકું-૨૦૨૬/૨૦૨૬-૨૭
 તા. ૨૭/૦૮/૨૦૨૬

શ્રી માન,

ઉપરોક્ત વિષય અને સંદર્ભિત પત્ર અન્વયે જાણાવવાનું કે, સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે.

આ ખેલ મહાકુંભમાં આપની શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવે અને ત્યાર બાદ ભાગ લે એ હેતુથી પ્રથમ શાળાકક્ષાએ, ત્યારબાદ ઝોનકક્ષાએ અને પછી મોરબી મહાનગરપાલિકા (જિલ્લા) કક્ષાએ ત્યારબાદ ઝોનથી રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભમાં કુલ ૩૮ (ઓગણચાલીસ) રમતો અને અંડર-૮, ૧૧, ૧૪, ૧૭, ઓપન એઈઝ, અબવ-૪૦ વર્ષ, તેમજ અબવ-૬૦ વર્ષ એમ કુલ ૭ (સાત) વયજૂથમાં સમાવેશ કરી સ્પર્ધાઓ યોજાશે. ખેલ મહાકુંભનું તા. ૨૮/૦૮/૨૦૨૬ના રોજ થી ખેલમહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ હોય, તેમાં રજીસ્ટ્રેશન www.khelnmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પરથી કરાવી શકશો. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 18002746151 પર સંપર્ક કરી શકશો.

નીચે જણાવેલ મુજબ વોર્ડ/ઝોનમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે પ્રમાણે આ વર્ષે રજીસ્ટ્રેશન કરવું.

પૂર્વ ઝોન (East Zone)	વોર્ડ નં. ૨, ૩, ૪, ૫, ૬ અને ૧૩
પશ્ચિમ ઝોન (West Zone)	વોર્ડ નં. ૧, ૭, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨
કુલ	૨ ઝોન / ૧૩ વોર્ડ

જે અન્વયે ઉપરોક્ત સંદર્ભિત પત્ર મુજબ ભાગ લેનાર ખેલાડીઓનું અં-૮, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ વયજૂથ માં ભાગ લેવા માટે ફરજિયાત જે તે શાળા દ્વારા જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત ભાગ લેવા માટે ખેલાડીઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.



DISTRICT SPORTS COACHING CENTRE, MORBI.

SPORTS AUTHORITY OF GUJARAT

Dept. of Sports Youth & Cultural Activities Govt. of Gujarat



Ref. No./D.S.C.C.:

Date :

રજીસ્ટ્રેશન થયા વગરના કોઈ પણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ. ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ: ૨૯-૦૮-૨૦૨૬ થી તા.૨૨-૦૯-૨૦૨૬ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે જેથી આપની યાજનાના ખેલાડીઓ ભાગ લેવામાં વંચિત રહી ન જાય તે માટે ખેલાડીઓનું ઉપરોક્ત સમય મર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ખેલ મહાકુંભ એ સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ક્ષેત્રગ્રામીય કાર્યક્રમ હોઈ તેને સફળ અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે.


બીડાણ :

૧) ખેલ મહાકુંભ પરિપત્ર તા.૨૭/૦૮/૨૦૨૬

૨) રમતો,ઈવેન્ટો દર્શાવતું માહિતી ફોર્મ


જિલ્લા રમત વિકાસ અધિકારી
મોરબી


જિલ્લા રમતગમત અધિકારી
મોરબી


જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
મોરબી


જિલ્લા શિક્ષણ અધિકારી
મોરબી

નકલ સવિનય જાણ સાર:-

૧. અગ્રસચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર.
૨. કમિશનરશ્રી, મોરબી મહાનગરપાલિકા.
૩. પોલીસ કમિશનરશ્રી, મોરબી શહેર,
૪. સચિવશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર
૫. પ્રમુખ/મંત્રીશ્રી, વ્યાયામ મંડળ, મોરબી શહેર
૬. પ્રમુખ/મંત્રીશ્રી રમતગમત એશોસિએશન, મોરબી

પરિશિષ્ટ - અ

ખેલ મહાકુંભ - મોરબી મહાનગરપાલિકા

ઝોનવાર વોર્ડ તથા વિસ્તારની વિગત

૧. પૂર્વ ઝોન

વોર્ડ	મુખ્ય વિસ્તાર
વોર્ડ નં. ૨	મચ્છુ નદીથી અમરેલી, શંકરા આશ્રમ, મોરબી-નવલખી રેલવે લાઈન, વીસી ફાટક, એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, મોરબી રેલવે સ્ટેશન, આરકલી, લાયન્સનગર અને કુબેરનગર વિસ્તાર
વોર્ડ નં. ૩	મચ્છુ નદીથી કાલિન્દ્રી નદી, કડિયા બોર્ડિંગ, લાલબાગ સરકારી વસાહત, લાલબાગ સેવા સદન, ઉમા ટાઉનશિપ, PGVCL કચેરી તથા મચ્છુ નદી કાંઠો
વોર્ડ નં. ૪	મહેન્દ્રનગર, કાલિન્દ્રી નદી આસપાસનો વિસ્તાર, મોરબી-ધૂટું રોડ તથા ત્રાજપર ચોકડી રોડ સુધીનો વિસ્તાર
વોર્ડ નં. ૫	મચ્છુ નદીથી L.E. કોલેજ હોસ્ટેલ, નટરાજ ફાટક, તાલુકા પોલીસ સ્ટેશન, મહારાણા પ્રતાપ સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જિલ્લા સેવા સદન, જિલ્લા પોલીસ અધિકાર કચેરી તથા મયુર પુલ વિસ્તાર
વોર્ડ નં. ૬	શક્તિ ચોકથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, ન્યાયાધીશ આવાસ, મણી મંદિર, દરબારગઢ, મચ્છુબારી, રામઘાટ રોડ, માતૃમંદિર પ્રાથમિક શાળા, ગંધીયા બજાર, નેહરુ ગેટ તથા બુઢાવાળી લાઈન
વોર્ડ નં. ૧૩	માધાપર, સાયન્ટિફિક વાડી, શિવ સોસાયટી, વજેપર, મતવાવાસ, રબારીવાસ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વાઘપરા, સદભાવના હોસ્પિટલ, બોયઝ હાઈસ્કૂલ, વસંત પ્લોટ, ગાંધી ચોક, ભોઈવાડો તથા સ્મશાન સુધીનો વિસ્તાર

૨. પશ્ચિમ ઝોન

વોર્ડ	મુખ્ય વિસ્તાર
વોર્ડ નં. ૧	નાની વાવડીના સર્વે નંબરો, કેનાલ આસપાસનો વિસ્તાર, શ્રીરામ પાર્ક, ભગવતીપરા તથા નદી સુધીનો વિસ્તાર
વોર્ડ નં. ૭	માધાપર, નવી રેલવે કોલોની, વીસી હાઈસ્કૂલ, જૂનું આયુર્વેદિક દવાખાનું, ટાઉન હોલ, મહાનગરપાલિકા કચેરી, શનાળા રોડ, રામચોક, લાતી પ્લોટ મેઈન રોડ, મહેન્દ્રપરા મેઈન રોડથી અયોધ્યાપુરી રોડ સુધી
વોર્ડ નં. ૮	પંચાસર રોડ, ભારતપરા, લાતી પ્લોટ, શનાળા રોડ, યદુનંદન ચેમ્બર્સ, સુભાષચંદ્ર બોઝ પ્રતિમા ચોક, નવા બસ સ્ટેન્ડ તથા સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીનો વિસ્તાર
વોર્ડ નં. ૯	સર્વે નં. ૮૬૪ થી ૧૨૭૦, તેમજ સર્વે નં. ૧૧૪૧, ૮૫૧ અને ૮૮૨ આસપાસનો વિસ્તાર
વોર્ડ નં. ૧૦	માધાપરના સર્વે નંબરોના વિસ્તારો, વોકળા તથા તળાવ આસપાસનો વિસ્તાર
વોર્ડ નં. ૧૧	રવાપર અને લીલાપરના સર્વે નંબરો ધરાવતો વિસ્તાર તથા મચ્છુ નદી આસપાસનો પટ્ટો
વોર્ડ નં. ૧૨	શનાળા રોડ, સરદાર બાગ, રવાપર મેઈન રોડ, કાલિકા પ્લોટ, કબીર ટેકરી વિસ્તાર તથા કેનાલ રોડ આસપાસનો વિસ્તાર



ક્રમાંક:એસએજી/ખેમકું ૨૦૨૬/૨૦૨૬-૨૭
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત
વહીવટી બિલ્ડીંગ,
સેક્ટર-૧૩, બી, ખ-૩ સર્કલ નજીક,
વાવોલ રેલ્વે કોસીંગ પાસે,
ગાંધીનગર. તા. ૨૭/૦૮/૨૦૨૬

વિષય:- ખેલ મહાકુંભ-૨૦૨૬ રજિસ્ટ્રેશન બાબત

પરિપત્ર:-

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.

(૧) રજિસ્ટ્રેશન:-

- ખેલ મહાકુંભ-૨૦૨૬નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૬થી શરૂ કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ-૨૦૨૬ના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૨/૦૮/૨૦૨૬ સાંજે ૬.૦૦ સુધીની રહેશે.
- ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઈટ <https://khelmahakumbh.gujarat.gov.in> પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
- પ્રત્યેક ખેલાડી પોતાની વયજૂથમાં લાગુ પડતા કોઈપણ એક વયજૂથમાં મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. એક જ KMK IDથી ખેલાડીએ બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK IDથી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે.
- જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જુના KMK IDથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે.
- કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.
- અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

(૨) સ્પર્ધાઓ

૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	રમત
૧	૯ વર્ષથી નીચે	૩૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૨	૧૧ વર્ષથી નીચે	૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૩	૧૪ વર્ષથી નીચે	એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૪	૧૭ વર્ષથી નીચે	એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૫	ઓપન એજ ગ્રુપ	એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૬	૪૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ
૭	૬૦ વર્ષથી ઉપર	રસ્સાખેંચ

૨. તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	ચેસ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, ચેસ, યોગાસન
૫	૪૦ વર્ષથી ઉપર	ચેસ
૬	૬૦ વર્ષથી ઉપર	ચેસ

૩. જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન
૨	૧૪ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૩	૧૭ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, રઝબી
૪	ઓપન એજ ગ્રુપ	સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રઝબી, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૫	૪૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ, શુટીંગબોલ
૬	૬૦ વર્ષથી ઉપર	બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ

૪. સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ

ક્રમ	વયજૂથ	રમત
૧	૧૧ વર્ષથી નીચે	સ્વીમીંગ, સ્કેટીંગ
૨	૧૪ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્મ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ
૩	૧૭ વર્ષથી નીચે	એથલેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવોન્ડો, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીક્સ, સ્કેટીંગ, મલખમ્મ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ
૪	ઓપન એજ ગ્રુપ	એથલેટીક્સ, સ્વીમીંગ, ટેકવોન્ડો, જુડો, કુસ્તી, આર્ચરી, જિમ્નાસ્ટીક્સ, સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્કેટીંગ, વેઈટલીફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, મલખમ્મ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ
૫	૪૦ અને ૬૦ વર્ષથી ઉપર	યોગાસન

(3) સામાન્ય નિયમો :-

- સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ 31/03/2020 રહેશે.
- જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
- રજિસ્ટ્રેશન કરતી વખતે જેતે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે.
- શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
- કોઈ પણ રમતવીર પોતાના તાલુકા/જિલ્લામાંથી મહત્તમ બે જ રમતમાં ભાગ લઈ શકશે.
- જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (ડી.એલ.એસ.એસ)ના વ્યક્તિગત રમતમાં તમામ ખેલાડીઓ અને સાંધિક રમતમાં માત્ર ૧ જ ટીમએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી સ્પર્ધાઓ પૈકી સીધે સીધો જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (ડી.એલ.એસ.એસ)ના બાકીના ખેલાડીઓ જે તે કક્ષાએથી શરૂ થતી સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. પરંતુ ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે.
- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની જે તે રમતના એકેડમીના વ્યક્તિગત રમતમાં તમામ ખેલાડીઓ અને સાંધિક રમતમાં માત્ર ૧ જ ટીમએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી સ્પર્ધાઓ પૈકી સીધે સીધો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની એકેડમીના બાકીના ખેલાડીઓ જે તે કક્ષાએથી શરૂ થતી સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. પરંતુ ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે.
- શક્તિદ્રુત યોજનાના ખેલાડીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૬માં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ફરજિયાત ભાગ લેવાનો રહેશે. પરંતુ ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે.
- બોકસીંગ, જુડો, કરાટે, ટેકવોન્ડો, વેઇટલીફ્ટીંગ તથા કુસ્તી અને વેઇટ કેટેગરીની તમામ સ્પર્ધામાં ખેલાડીએ જે વજન ગ્રુપમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે જ વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે. સ્પર્ધા સમયે વજન અને વયજુથમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
- ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
- જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
- કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલાં બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે.
- સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, બોનાફાઈડ અને બેંકની પાસબુકની નકલ ફરજિયાત સાથે લઈને આવવાની રહેશે.

- રજિસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર. ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.
- રજિસ્ટ્રેશન અંગેનો આખરી નિર્ણય સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનો રહેશે.
- રજિસ્ટ્રેશનના પરીપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા કરવા અંગેની સત્તા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની રહેશે.

ખેલ મહાકુળ એ સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ફલેગશીપ કાર્યક્રમ હોઈ તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે.



સચિવ

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત
ગાંધીનગર

બિડાણ:-પત્રક- અ - રોકડ- પુરસ્કાર

નકલ સવિનય રવાના જાણ સારું

(૧) અધિક અંગત સચિવશ્રી,

માન. નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકાર

(૨) અંગત સચિવશ્રી,

માન. મંત્રીશ્રી, રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત સરકાર, ગાંધીનગર

(૩) અંગત મદદનીશશ્રી,

માન. સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
પ્રતિ,

(૧) કલેક્ટરશ્રી, તમામ

(૨) મ્યુ.કમિશ્નરશ્રી, તમામ

(૩) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ

(૪) વાઈસ ચાન્સેલરશ્રી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, વડોદરા

(૫) કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર

(૬) કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

(૭) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

(૮) નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ, ગાંધીનગર

(૯) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

(૧૦) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

(૧૧) પ્રિન્સીપાલશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન તમામ

(૧૨) શાસનાધિકારીશ્રી, મ્યુનિ.કોર્પોરેશન તમામ

(૧૩) પ્રમુખ/મંત્રીશ્રી, રાજ્યકક્ષાના માન્ય રમતગમત મંડળો

(૧૪) જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તમામ

(૧૫) જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, તમામ

(૧૬) શાખા અધિકારીશ્રી, એસ.એ.જી., તમામ

પત્રક-અ

ખેલ મહાકુંભ-૨૦૨૬					
તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર					
૧	ખેલાડીઓ	તાલુકાકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતિય	૧૦૦૦	૭૫૦
			તૃતિય	૭૫૦	૫૦૦
		જિલ્લાકક્ષા	પ્રથમ	૫૦૦૦	૩૦૦૦
			દ્વિતિય	૩૦૦૦	૨૦૦૦
			તૃતિય	૨૦૦૦	૧૦૦૦
		રાજ્યકક્ષા	પ્રથમ	૧૦૦૦૦	૫૦૦૦
			દ્વિતિય	૭૦૦૦	૩૦૦૦
			તૃતિય	૫૦૦૦	૨૦૦૦
શ્રેષ્ઠ શાળા					
૨	શાળા	તાલુકાકક્ષા	પ્રથમ	૨૫૦૦૦	-
			દ્વિતિય	૧૫૦૦૦	-
			તૃતિય	૧૦૦૦૦	-
૩	શાળા	જિલ્લાકક્ષા	પ્રથમ	૧૫૦૦૦૦	-
			દ્વિતિય	૧૦૦૦૦૦	-
			તૃતિય	૭૫૦૦૦	-
૪	શાળા	રાજ્યકક્ષા	પ્રથમ	૫૦૦૦૦૦	-
			દ્વિતિય	૩૦૦૦૦૦	-
			તૃતિય	૨૦૦૦૦૦	-

રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓના કોચને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર					
ક્રમ	વિગત	કક્ષા	વિજેતા ક્રમ	વ્યક્તિગત રૂ.	ટીમ રૂ.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગ્રુપ					
૧	કોચ	રાજ્યકક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૦૦૦
			દ્વિતિય	૧૨૦૦	૭૫૦
			તૃતિય	૮૦૦	૫૦૦



ખેલ મહાકુંભ-૨૦૨૬



અંક ૨૯ (તા.૦૧/૦૪/૨૦૧૮ અને તે પછી જન્મેલા)

(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ✓ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	☐ ૩૦ મીટર ☐ સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
-----------	---

અંક ૨૧ (તા.૦૧/૦૪/૨૦૧૬ અને તે પછી જન્મેલા)

(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ✓ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	☐ ૫૦ મીટર ☐ સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
-----------	---

સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

ચેસ	☐ ચેસ
-----	------------------------------

સીધી જિલ્લા/મેટ્રોપોલિટન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	☐ ૧૦૦ મીટર ☐ લાંબી કુદ
સ્કેટીંગ	ફ્લોડ ☐ રીક ૧ (૫૦૦ મી.) ☐ રીક ૨ (૧૦૦૦ મી.)
	ઇનલાઇન ☐ રીક ૩ (૫૦૦ મી.) ☐ રીક ૪ (૧૦૦૦ મી.)
સ્વીમીંગ	☐ ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ
બેડમીન્ટન	☐ સીંગલ્સ
ટેબલ ટેનીસ	☐ સીંગલ્સ
લોન ટેનીસ	☐ સીંગલ્સ

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

સ્વીમીંગ	વ્યક્તિગત મીડલે (૨૦૦ મીટર)
સ્કેટીંગ	ફ્લોડ ☐ રોડ ૧ (૧૫૦૦ મી.)
	ઇનલાઇન ☐ રોડ ૨ (૫૦૦મી) ☐ રોડ રેસ ૩ (૧૫૦૦મી)

અંક ૧૪ (તા.૦૧/૦૪/૨૦૧૩ અને તે પછી જન્મેલા)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	☐ ૧૦૦મીટર ☐ લાંબીકુદ ☐ ગોળા ફેંક
વોલીબોલ	☐ વોલીબોલ
ખો-ખો	☐ ખો-ખો
કબડ્ડી	☐ ભાઈઓ (૫૧ કિગ્રા) ☐ બહેનો (૪૮ કિગ્રા)

નોંધ:-યોગ્યતા માટે,

- > ગ્રુપ-Aપરિમોતાસન,સર્વોગાસન,મત્સ્યાસન,અર્ધમત્સ્યસન,પુલ્લે ધનુરાસન, ઉતાન પાદાસન
- > ગ્રુપ-B પુલ્લે ચક્રાસન, કુકુટાસન, ભુમાસનપુલ્લે, સલભાસન, બકાસન,સિર્ષાસન
- > ગ્રુપ-C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિશતિતિવાસન, પશ્ચ મથુરાસન,ઉત્તિશપાદકસાસન
- > રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમાશે.

સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	☐ ૨૦૦ મીટર ☐ ૪૦૦ મીટર ☐ ૬૦૦ મીટર ☐ ઉર્થીકુદ ☐ ચક્રફેંક
ચેસ	☐ ચેસ
યોગાસન	☐ વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)

સીધી જિલ્લા/મેટ્રોપોલિટન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

યોગાસન	☐ આર્ટિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) ☐ રિધમીક યોગા
આર્ચરી	☐ ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરઓલ)
સ્વીમીંગ	☐ ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ ☐ બેક સ્ટ્રોક ૧૦૦ મી ☐ બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
	☐ ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ ☐ બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી ☐ વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
આર્ટીસ્ટીક સ્કેટીંગ	☐ ફ્રી સ્કેટીંગ ☐ સોલોડાન્સ ☐ ફીગર ☐ ફ્લોટેટ
સ્કેટીંગ	ફ્લોડ ☐ રીક ૧ (૫૦૦ મી.) ☐ રીક ૨ (૧૦૦૦ મી.)
	ઇનલાઇન ☐ રીક ૩ (૫૦૦ મી.) ☐ રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ ☐ ૨૫ કિગ્રા સુધી ☐ ૨૫ કિગ્રાથી ઉપર અને -૩૦ કિગ્રા સુધી ☐ ૩૦ કિગ્રાથી ઉપર અને -૩૫ કિગ્રા સુધી ☐ ૩૫ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી
	બહેનો ☐ ૨૩ કિગ્રા સુધી ☐ ૨૩ કિગ્રાથી ઉપર અને -૨૭ કિગ્રા સુધી ☐ ૨૭ કિગ્રાથી ઉપર અને -૩૨ કિગ્રા સુધી ☐ ૩૨ કિગ્રાથી ઉપર અને -૩૬ કિગ્રા સુધી
કુસ્તી	ભાઈઓ ☐ ૩૦-૩૫ કિગ્રા ☐ ૩૫-૩૮ ☐ ૩૮-૪૧ કિગ્રા ☐ ૪૧-૪૪ કિગ્રા ☐ ૪૪-૪૮ કિગ્રા
	બહેનો ☐ ૨૬-૩૦ કિગ્રા ☐ ૩૦-૩૩ કિગ્રા ☐ ૩૩-૩૬ કિગ્રા ☐ ૩૬-૩૯ કિગ્રા ☐ ૩૯-૪૨ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ ☐ ૧૮ કિગ્રા સુધી ☐ ૧૮-૨૧ કિગ્રા ☐ ૨૩-૨૫ કિગ્રા ☐ ૨૭-૨૯ કિગ્રા ☐ ૪૧ કિગ્રાથી ઉપર
	બહેનો ☐ ૧૬ કિગ્રા સુધી ☐ ૧૮-૨૦ કિગ્રા ☐ ૨૨-૨૪ કિગ્રા ☐ ૨૬-૨૯ કિગ્રા ☐ ૩૮ કિગ્રાથી ઉપર
બેડમીન્ટન	☐ સીંગલ્સ
બાસ્કેટબોલ	☐ બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	☐ સીંગલ્સ
લોન ટેનીસ	☐ સીંગલ્સ
હેન્ડબોલ	☐ હેન્ડબોલ
ફોક્લી	☐ ફોક્લી
કુટબોલ	☐ કુટબોલ
કરાટે	ભાઈઓ ☐ ૨૦ કિગ્રા સુધી ☐ ૨૦-૨૫ કિગ્રા ☐ ૨૫-૩૦ કિગ્રા ☐ ૩૦-૩૫ કિગ્રા ☐ ૩૫-૪૦ કિગ્રા ☐ ૪૦-૪૫ કિગ્રા ☐ ૪૫-૫૦ કિગ્રા ☐ ૫૦-૫૫ કિગ્રા ☐ ૫૫-૬૦ કિગ્રા ☐ ૬૦ કિગ્રાથી ઉપર
	બહેનો ☐ ૧૮ કિગ્રા સુધી ☐ ૧૮-૨૨ કિગ્રા ☐ ૨૨-૨૪ કિગ્રા ☐ ૨૪-૨૬ કિગ્રા ☐ ૨૬-૩૦ કિગ્રા ☐ ૩૦-૩૪ કિગ્રા ☐ ૩૪-૩૮ કિગ્રા ☐ ૩૮-૪૨ કિગ્રા ☐ ૪૨-૪૬ કિગ્રા ☐ ૪૬-૫૦ કિગ્રા ☐ ૫૦ કિગ્રાથી ઉપર

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- > યોગાસનમાં પ્રેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં ફ્લોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કારાટે અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
- > કુસ્તી, ટેકવેન્ડો, અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

એથલેટીક્સ	☐ ૮૦ મી ફર્ડલ્સ ☐ ૪ x ૧૦૦ મી રીલે														
સ્વીમીંગ	☐ ફ્રી સ્ટાઈલ ૫૦મી ☐ ફ્રી સ્ટાઈલ ૨૦૦મી ☐ ફ્રી સ્ટાઈલ રીલે ૪ x ૧૦૦મી ☐ બેક સ્ટ્રોક ૫૦ મી ☐ બેક સ્ટ્રોક ૨૦૦ મી ☐ મીડલે રીલે ૪ x ૧૦૦મી ☐ બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી ☐ બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦મી ☐ બટર ફ્લાય સ્ટ્રોક ૫૦ મી ☐ બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી														
	➤ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં બેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે														
જુડો	ભાઈઓ	☐ ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૫ કિગ્રા સુધી ☐ ૪૫ કિગ્રાથી ઉપર અને -૫૦ કિગ્રા સુધી ☐ ૫૦ કિગ્રાથી ઉપર													
	બહેનો	☐ ૩૬ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી ☐ ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૪ કિગ્રા સુધી ☐ ૪૪ કિગ્રાથી ઉપર													
કુસ્તી	ભાઈઓ	☐ ૪૮-૫૨ કિગ્રા ☐ ૫૨-૫૭ કિગ્રા ☐ ૫૭-૬૨ કિગ્રા ☐ ૬૨-૬૮ કિગ્રા ☐ ૬૮-૭૫ કિગ્રા													
	બહેનો	☐ ૪૨-૪૬ કિગ્રા ☐ ૪૬-૫૦ કિગ્રા ☐ ૫૦-૫૪ કિગ્રા ☐ ૫૪-૫૮ કિગ્રા ☐ ૫૮-૬૨ કિગ્રા													
ટેકવેન્ડો	ભાઈઓ	☐ ૨૧-૨૩ કિગ્રા ☐ ૨૫-૨૭ કિગ્રા ☐ ૨૯-૩૨ કિગ્રા ☐ ૩૨-૩૫ કિગ્રા ☐ ૩૫-૩૮ કિગ્રા ☐ ૩૮-૪૧ કિગ્રા													
	બહેનો	☐ ૧૬-૧૮ કિગ્રા ☐ ૨૦-૨૨ કિગ્રા ☐ ૨૪-૨૬ કિગ્રા ☐ ૨૯-૩૨ કિગ્રા ☐ ૩૨-૩૫ કિગ્રા ☐ ૩૫-૩૮ કિગ્રા													
જીમ્નાસ્ટીક	ભાઈઓ	☐ ફ્લોર એક્સાઈઝ ☐ વોલ્ટીંગ ટેબલ ☐ રોમનરીંગ ☐ પેરલલબાર ☐ પોમલોસ ☐ ફોરજોન્ટલબાર													
	બહેનો	☐ ફ્લોર એક્સાઈઝ ☐ વોલ્ટીંગ ટેબલ ☐ બેલેસીંગબીમ ☐ અનઈવનબાર ☐ ફૂપ(રિધમીક) ☐ ક્લબ(રિધમીક) ☐ બોલ(રિધમીક) ☐ રીબન (રિધમીક)													
સ્કેટીંગ	ફ્વોડ	☐ રોડ ૧ (૨૦૦૦ મી.)													
	ઈનલાઈન	☐ રોડ ૨ (૫૦૦ મી.) ☐ રોડ રેસ ૩ (૨૦૦૦ મી.)													
આર્ચરી	રીકર્વ રાઉન્ડ	☐ વ્યક્તિગત ઓવરઓલ ☐ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ ☐ ટીમ ☐ મીક્ષ ટીમ													
	કમ્પાઉન્ડ રાઉન્ડ	☐ વ્યક્તિગત ઓવરઓલ ☐ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ ☐ ટીમ ☐ મીક્ષ ટીમ													
શુટીંગ	☐ ૧૦ મી.એર પીસ્ટોલ ☐ ૧૦ મી. એર રાયફલ પીપ ☐ ૧૦ મી. ઓપન સાઇટ એર રાઇફલ														
ફેન્સીંગ	☐ ફોઇલ ☐ ઈપી ☐ સેબર														
બોક્સીંગ	ભાઈઓ	☐ ૨૮-૩૦ કિગ્રા ☐ ૩૦-૩૨ કિગ્રા ☐ ૩૨-૩૪ કિગ્રા ☐ ૩૪-૩૬ કિગ્રા ☐ ૩૬-૩૮ કિગ્રા ☐ ૩૮-૪૦ કિગ્રા ☐ ૪૦-૪૨ કિગ્રા ☐ ૪૨-૪૪ કિગ્રા ☐ ૪૪-૪૬ કિગ્રા ☐ ૪૬-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૦ કિગ્રા													
મલખંસ	☐ રોપ મલખંસ (ફક્ત બહેનો માટે) ☐ પોલ મલખંસ (ફક્ત ભાઈઓ માટે)														
રોલબોલ	☐ રોલબોલ														
સેપક ટકરાવ	☐ રેગુ ☐ ફ્વોડસ														
સ્પોર્ટ્સ ક્લામીંગ	☐ લીડ ક્લામીંગ ☐ સ્પીડ ક્લામીંગ ☐ બોલ્ડરીંગ														

➤ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 ➤ શુટીંગ સ્પર્ધામાં એર પીસ્ટોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

બેલ મહાકુંભ-૨૦૨૬

અંડર ૧૭ (તા.૦૧/૦૪/૨૦૧૦ અને તે પછી જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ☒ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે).

❖ સીધી સાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

એથલેટીક્સ	☐ ૧૦૦ મી. ☐ લાંબીફે ☐ લંડગડાળ કુદ ☐ ગોળાફેક														
રસ્સાખેંચ	☐ ભાઈઓ ૪૮૦ કિગ્રા ☐ બહેનો ૪૦૦ કિગ્રા નોંધ: (૮ બેલાડીઓનું કુલ વજન)														
વોલીબોલ	☐ વોલીબોલ														
ખો-ખો	☐ ખો-ખો														
કબડ્ડી	☐ ભાઈઓ (૫૫ કિગ્રા) ☐ બહેનો (૫૫ કિગ્રા)														

❖ સીધી તાલુકા/ઝોનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

એથલેટીક્સ	☐ ૨૦૦મી ☐ ૪૦૦મી ☐ ૮૦૦ મી ☐ ૧૫૦૦ મી. ☐ ઉર્થીફે ☐ બરછીફેક ☐ ચક્રફેક														
ચેસ	☐ ચેસ														
યોગાસન	☐ વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)														

નોંધ:-યોગાસન માટે.
 ➤ ગ્રુપ-Aપશ્ચિમોતાસન,સર્વાંગાસન,મત્સ્યાસન,અર્ધમત્સ્યેન્દ્રાસન,પુર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન
 ➤ ગ્રુપ-B પુર્ણ ચક્રાસન, કુકુટાસન, ભુમાસનપુર્ણ, સલભાસન, બકાસન,શિર્ષાસન
 ➤ ગ્રુપ- C સામ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિથતિતિવાસન, પશ્ચ મધુરાસન,ઉત્તિથપાદરસ્તાસન
 ➤ રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમાશે.

❖ સીધી જિલ્લા/મેયોરશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖

આર્ચરી	☐ ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરઓલ)														
યોગાસન	☐ આર્ટિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) ☐ રિધમીક યોગા														
સ્વીમીંગ	☐ ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ ☐ બેક સ્ટ્રોક ૧૦૦ મી ☐ બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી. ☐ ૪૦૦ મી.ફ્રી સ્ટાઈલ ☐ બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી ☐ વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.														
	સ્કેટીંગ	ફ્વોડ	☐ રીક ૧ (૫૦૦ મી.) ☐ રીક ૨(૧૦૦૦ મી.)												
જુડો	ભાઈઓ	☐ ૪૦ કિગ્રા સુધી ☐ ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૫ કિગ્રા સુધી ☐ ૪૫ કિગ્રાથી ઉપર અને -૫૦ કિગ્રા સુધી ☐ ૫૦ કિગ્રાથી ઉપર અને -૫૫ કિગ્રા સુધી ☐ ૫૫ કિગ્રાથી ઉપર અને -૬૦ કિગ્રા સુધી													
	બહેનો	☐ ૩૬ કિગ્રા સુધી ☐ ૩૬ કિગ્રાથી ઉપર અને -૪૦ કિગ્રા સુધી ☐ ૪૦ કિગ્રાથી ઉપર અને -૪૪ કિગ્રા સુધી ☐ ૪૪ કિગ્રાથી ઉપર અને -૪૮ કિગ્રા સુધી ☐ ૪૮ કિગ્રાથી ઉપર અને -૫૨ કિગ્રા સુધી													
કુસ્તી	ભાઈઓ-ફ્રીસ્ટાઇલ	☐ ૪૧-૪૫ કિગ્રા ☐ ૪૫-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૧ કિગ્રા ☐ ૫૧-૫૫ કિગ્રા ☐ ૫૫-૬૦ કિગ્રા													
	બહેનો-ફ્રીસ્ટાઇલ	☐ ૩૬-૪૦ કિગ્રા ☐ ૪૦-૪૩ કિગ્રા ☐ ૪૩-૪૬ કિગ્રા ☐ ૪૬-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૩ કિગ્રા													
ટેકવેન્ડો	ભાઈઓ	☐ ૩૫ કિગ્રા સુધી ☐ ૩૫ -૩૮ કિગ્રા ☐ ૪૧-૪૫ કિગ્રા ☐ ૪૮-૫૧ કિગ્રા ☐ ૫૫-૫૯ કિગ્રા ☐ ૭૮ કિગ્રા થી ઉપર													
	બહેનો	☐ ૩૨ કિગ્રા સુધી ☐ ૩૮-૪૨ કિગ્રા ☐ ૪૪-૪૬ કિગ્રા ☐ ૫૨-૫૫ કિગ્રા ☐ ૬૮ કિગ્રા થી ઉપર													
બેડમીન્ટન	☐ સીંગલ્સ														
બાસ્કેટબોલ	☐ બાસ્કેટબોલ														
ટેબલ ટેનીસ	☐ સીંગલ્સ														
લોન ટેનીસ	☐ સીંગલ્સ														
હેન્ડબોલ	☐ હેન્ડબોલ														
હોકી	☐ હોકી														
કુટબોલ	☐ કુટબોલ														
કરાટે	ભાઈઓ	☐ ૩૫ કિગ્રા સુધી ☐ ૩૫-૪૦ કિગ્રા ☐ ૪૦-૪૫ કિગ્રા ☐ ૪૫-૫૦ કિગ્રા ☐ ૫૦-૫૪ કિગ્રા ☐ ૫૪-૫૮ કિગ્રા ☐ ૫૮-૬૨ કિગ્રા ☐ ૬૨-૬૬ કિગ્રા ☐ ૬૬-૭૦ કિગ્રા ☐ ૭૦-૭૪ કિગ્રા ☐ ૭૪-૭૮ કિગ્રા ☐ ૭૮-૮૨ કિગ્રા ☐ ૮૨ કિગ્રાથી ઉપર													
	બહેનો	☐ ૩૨ કિગ્રા સુધી ☐ ૩૨-૩૬ કિગ્રા ☐ ૩૬-૪૦ કિગ્રા ☐ ૪૦-૪૪ કિગ્રા ☐ ૪૪-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૨ કિગ્રા ☐ ૫૨-૫૬ કિગ્રા ☐ ૫૬-૬૦ કિગ્રા ☐ ૬૦-૬૪ કિગ્રા ☐ ૬૪-૬૮ કિગ્રા ☐ ૬૮ થી ઉપર													
રઝમી	☐ રઝમી														

નોંધ:- સાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- યોગાસનમાં બેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- યોગાસનમાં બેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમા કવોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ

☐ 3000 મી

☐ 100 મી ફર્ડલ્સ (બહેનો)

☐ 110 મી ફર્ડલ્સ (ભાઈઓ)

☐ ૪ x ૧૦૦ મી રીલે

☐ વાંસફૂદ

☐ ફથોડા ફેક

☐ ૫ કી.મી.વોક(ભાઈઓ)

☐ ૩ કી.મી.વોક(બહેનો)

☐ ૪૦૦ મી ફર્ડલ્સ

સ્વીમીંગ

☐ ફ્રીસ્ટાઇલ ૫૦મી

☐ બેક સ્ટ્રોક ૨૦૦ મી

☐ બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી

☐ બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી

☐ ફ્રી સ્ટાઇલ ૮૦૦મી (ભાઈઓ)

☐ વ્યક્તિગત મીડલે ૪૦૦ મી

☐ ફ્રીસ્ટાઇલ ૨૦૦મી

☐ બેક સ્ટ્રોક ૫૦મી

☐ ફ્રીસ્ટાઇલ રીલે ૪ x ૧૦૦ મી

☐ બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી

☐ બટર ફ્લાય ૫૦મી

☐ મીડલે રીલે ૪ x ૧૦૦ મી

જુડો

ભાઈઓ

☐ 50 કિગ્રાથી ઉપર અને -55 કિગ્રા સુધી

☐ 55 કિગ્રાથી ઉપર અને -૭૩ કિગ્રા સુધી

☐ ૭૩ કિગ્રાથી ઉપર અને -૮1 કિગ્રા સુધી

☐ ૮1 કિગ્રાથી ઉપર અને -૯૦ કિગ્રા સુધી

☐ ૯૦ કિગ્રાથી ઉપર

બહેનો

☐ ૫૨ કિગ્રાથી ઉપર અને -૫૭ કિગ્રા સુધી

☐ ૫૭ કિગ્રાથી ઉપર અને -53 કિગ્રા સુધી

☐ 53 કિગ્રાથી ઉપર અને -૭0 કિગ્રા સુધી

☐ ૭0 કિગ્રાથી ઉપર

કુસ્તી

ભાઈઓ (ફ્રીસ્ટાઇલ)

☐ 50-5૫ કિગ્રા

☐ 5૫-૭1 કિગ્રા

☐ ૭1-૮0 કિગ્રા

☐ ૮૦-૯૨ કિગ્રા

☐ ૯૨-110 કિગ્રા

બહેનો (ફ્રીસ્ટાઇલ)

☐ ૫૩- ૫૭ કિગ્રા

☐ ૫૭-59 કિગ્રા

☐ 59-5૫ કિગ્રા

☐ 5૫-5૯ કિગ્રા

☐ 5૯-૭3 કિગ્રા

ટેકવેન્ડો

ભાઈઓ

☐ 3૮-૪1 કિગ્રા

☐ ૪૫-૪૮ કિગ્રા

☐ ૫1-૫૫ કિગ્રા

☐ ૫૮-53 કિગ્રા

☐ 53-5૮ કિગ્રા

☐ 5૮-૭૩ કિગ્રા

☐ ૭૩-૭૮ કિગ્રા

બહેનો

☐ 3૨-3૫ કિગ્રા

☐ 3૫-3૮ કિગ્રા

☐ ૪૨-૪૪ કિગ્રા

☐ ૪5-૪૯ કિગ્રા

☐ ૪૯-૫૨ કિગ્રા

☐ ૫૫-૫૯ કિગ્રા

☐ ૫૯-53 કિગ્રા

☐ 53-5૮ કિગ્રા

જીમ્નાસ્ટીક

ભાઈઓ

☐ ફ્લોર એક્સાઈઝ

☐ વોલ્ટીંગ ટેબલ

☐ રોમનરીંગ

☐ પેરલલબાર

☐ પોમેલક્સેસ

☐ ક્લેરિજોટલબાર

બહેનો

☐ ફ્લોર એક્સાઈઝ

☐ વોલ્ટીંગ ટેબલ

☐ બેલેસીંગબીમ

☐ અનઈવનબાર

☐ ફૂપ (રિધમીક)

☐ કલબ(રિધમીક)

☐ બોલ(રિધમીક)

☐ રીબન (રિધમીક)

સ્કેટીંગ

કવોડ

☐ રોડ રેસ ૩ (3000 મી.)

ઇનલાઈન

☐ રોડ રેસ ૨ (૫00 મી.)

☐ રોડ રેસ ૩ (3000 મી.)

આર્ચરી

રીકવં રાઉન્ડ

☐ વ્યક્તિગત ઓવરઓલ

☐ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ

☐ ટીમ

☐ મીક્સ ટીમ

કમ્પાઉન્ડ રાઉન્ડ

☐ વ્યક્તિગત ઓવરઓલ

☐ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ

☐ ટીમ

☐ મીક્સ ટીમ

શુટીંગ

☐ 10 મી.એર પીસ્તોલ

☐ 10 મી.પીપ સાઈટ એર રાયફલ

☐ 10 મી. ઓપન સાઇટ એર રાયફલ

વેઇટલીફ્ટીંગ

ભાઈઓ

☐ ૪૯ કિગ્રા સુધી

☐ ૫૫ કિગ્રા

☐ 59 કિગ્રા

☐ 5૭ કિગ્રા

☐ ૭3 કિગ્રા

☐ ૮1 કિગ્રા

☐ ૮૯ કિગ્રા

☐ ૯5 કિગ્રા

☐ 10૨ કિગ્રા

☐ 10૨ કિગ્રા થી ઉપર

બહેનો

☐ ૪0 કિગ્રા સુધી

☐ ૪૫ કિગ્રા

☐ ૪૯ કિગ્રા

☐ ૫૫ કિગ્રા

☐ ૫૯ કિગ્રા

☐ 5૪ કિગ્રા

☐ ૭1 કિગ્રા

☐ ૭5 કિગ્રા

☐ ૮1 કિગ્રા

☐ ૮1 કિગ્રા થી ઉપર

ફેન્સીંગ

☐ ફોઇલ

☐ ઈપી

☐ સેબર

બોક્સીંગ

ભાઈઓ

☐ ૪5 કિગ્રા સુધી

☐ ૪5-૪૮ કિગ્રા

☐ ૪૮-૫0 કિગ્રા

☐ ૫0-૫૨ કિગ્રા

☐ ૫૨-૫૪ કિગ્રા

☐ ૫૪-૫૭ કિગ્રા

☐ ૫૭-50 કિગ્રા

બહેનો

☐ 50-53 કિગ્રા

☐ 53-55 કિગ્રા

☐ 55-૭0 કિગ્રા

☐ ૭0-૭૫ કિગ્રા

☐ ૭૫-૮0 કિગ્રા

☐ ૮0 કિગ્રાથી ઉપર

☐ ૪૨ કિગ્રા સુધી

☐ ૪૨-૪૪ કિગ્રા

☐ ૪૪-૪5 કિગ્રા

☐ ૪5-૪૮ કિગ્રા

☐ ૪૮-૫0 કિગ્રા

☐ ૫0-૫૨ કિગ્રા

☐ ૫૨-૫૪ કિગ્રા

☐ ૫૪-૫૭ કિગ્રા

☐ ૫૭-50 કિગ્રા

☐ 50-53 કિગ્રા

☐ 53-55 કિગ્રા

☐ 55-૭0 કિગ્રા

☐ ૭0-૭૫ કિગ્રા

☐ ૭૫-૮0 કિગ્રા

☐ ૮0 થી ઉપર

મલખંભ

☐ રોપ મલખંભ (ફક્ત બહેનો માટે)

☐ પોલ મલખંભ (ફક્ત ભાઈઓ માટે)

રોલબોલ

☐ રોલબોલ

સેપક ટકરાવ

☐ રેગુ

☐ કવોડસ

સ્પોર્ટ્સ ક્લામીંગ

☐ લીડ ક્લામીંગ

☐ સ્પીડ ક્લામીંગ

☐ બોલ્ડરીંગ

સોકર ટેનીસ

☐ સીંગલ્સ

☐ ડબ્લ્સ

વુડબોલ

ફેરપ્લે

☐ સીંગલ્સ

☐ ડબ્લ્સ

☐ ટીમ

સ્ટ્રોક

☐ સીંગલ્સ

☐ ડબ્લ્સ

☐ ટીમ

શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. > શુટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

બેલ મહાફુલ-૨૦૨૬

ઓપન એઈજ ગ્રુપ (તા.0૧/૦૪/૧૯૨૭ અને તે પછી જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે

☒

કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ

☐ ૧૦૦ મી.

☐ લાંબીફૂદ

☐ લંગડીફાળ ફૂદ

☐ ગોળાફેંક

રસ્સાખેંચ

☐ ભાઈઓ ૫50 કિગ્રા

☐ બહેનો ૪૪૦ કિગ્રા

નોંધ: (૮ બેલાડીઓનું કુલ વજન)

વોલીબોલ

☐ વોલીબોલ

કબડી

☐ ભાઈઓ (૮૫કિગ્રા)

☐ બહેનો (૭૫કિગ્રા)

ખો-ખો

☐ ખો-ખો

સીધી તાલુકા / ઝિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ

☐ ૨૦૦મી

☐ ૪૦૦મી

☐ ૮૦૦ મી

☐ ૧૫૦૦ મી.

☐ 3000 મી

☐ ઉર્ચીફૂદ

☐ બરછીફેંક

☐ ચક્રફેંક

ચેસ

☐ ચેસ

યોગાસન

☐ વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)

સીધી જિલ્લા/મેયોરિશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

શુટીંગ બોલ

☐ ફક્ત ભાઈઓ માટે

બેડમીન્ટન

☐ સીંગલ્સ

☐ ડબ્લ્સ

☐ મિક્સ ડબ્લ્સ

યોગાસન

☐ આર્ટિસ્ટિક યોગા(ટ્રેડિશનલ)

☐ રિધમીક યોગા

(નોંધ:- યોગાસનમાં બેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.)

કુટબોલ

☐ કુટબોલ

બાસ્કેટબોલ

☐ બાસ્કેટબોલ

ટેબલ ટેનીસ

☐ સીંગલ્સ

☐ ડબ્લ્સ

☐ મિક્સ ડબ્લ્સ

લોન ટેનીસ

☐ સીંગલ્સ

☐ ડબ્લ્સ

☐ મિક્સ ડબ્લ્સ

હેન્ડબોલ

☐ હેન્ડબોલ

હોકી

☐ હોકી

સ્વીમીંગ

☐ 100 મી.ફ્રી સ્ટાઇલ

☐ બેક સ્ટ્રોક 100 મી

☐ બટર ફ્લાય સ્ટ્રોક 100 મી.

☐ ૪00 મી.ફ્રી સ્ટાઇલ

☐ બ્રેસ્ટ સ્ટ્રોક 100 મી

☐ વ્યક્તિગત મીડલે ૨00 મી.

આર્ટીસ્ટીક સ્કેટીંગ

☐ ફ્રી સ્કેટીંગ

☐ સોલોડાન્સ

☐ ફ્રીગર

સ્કેટીંગ

કવોડ

☐ રીક 1 (૫00 મી.)

☐ રીક ૨ (1000 મી.)

ઇન લાઈન

☐ રીક ૩ (૫00 મી.)

☐ રીક ૪ (1000 મી.)

જુડો

ભાઈઓ

☐ ૫૫ કિગ્રા સુધી

☐ ૫૫ કિગ્રાથી ઉપર અને -50 કિગ્રા સુધી

☐ 50 કિગ્રાથી ઉપર અને -55 કિગ્રા સુધી

બહેનો

☐ ૪૪ કિગ્રા સુધી

☐ ૪૪ કિગ્રાથી ઉપર અને -૪૮ કિગ્રા સુધી

☐ ૪૮ કિગ્રાથી ઉપર અને -૫૨ કિગ્રા સુધી

☐ ૫૨ કિગ્રાથી ઉપર અને -૫૭ કિગ્રા સુધી

કુસ્તી

ભાઈઓ

☐ ૪5-૫0 કિગ્રા

☐ ૫0-૫૭ કિગ્રા

☐ ૫૭-5૫ કિગ્રા

☐ 5૫-૭0 કિગ્રા

☐ ૭0-૭૪ કિગ્રા

બહેનો

☐ ૪5-૫0 કિગ્રા

☐ ૫0-૫3 કિગ્રા

☐ ૫3-૫૫ કિગ્રા

☐ ૫૫-૫૭ કિગ્રા

☐ ૫૭-૫૯ કિગ્રા

ટેકવેન્ડો

ભાઈઓ

☐ ૪૫ કિગ્રા સુધી

☐ ૪૫-૪૮ કિગ્રા

☐ ૫૫-૫૯ કિગ્રા

☐ 5૮-૭3 કિગ્રા

બહેનો

☐ ૪0 કિગ્રા સુધી

☐ ૫૨-૫૫ કિગ્રા

☐ 53-5૮ કિગ્રા

આર્ચરી

☐ ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરઓલ)

નોંધ-યોગાસન માટે, > ગ્રુપ-Aપશ્ચિમોતાસન,સર્વાંગાસન,મત્સ્યાસન,અર્ધમત્સ્યેન્દ્રાસન,પૂર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન > ગ્રુપ-B પૂર્ણ થકાસન, કુકુટાસન, ભુમાસનપૂર્ણ, સલભાસન, બકાસન,શિર્ષાસન > ગ્રુપ- C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિથિતિવાસન, પશ્ચ મથુરાસન,ઉત્તિથિપાદફલ્પાસન > રાજચક્રાએ બેસ્ટ ષોફ ધ બેસ્ટ રમાશે.

નોંધ- શાળાકક્ષાથી રાજચક્રા સુધીની સ્પર્ધા માટે > યોગાસનમાં બેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે. > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને 1 રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે. > જિલ્લાકક્ષા અને રાજચક્રાએ સ્કેટીંગમા કવોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોરમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે. > બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

Scanned with OKEN Scanner

કરાટે	ભાઈઓ	☐ ૩૫ કિગ્રા સુધી ☐ ૩૫-૪૦ કિગ્રા ☐ ૪૦-૪૫ કિગ્રા ☐ ૪૫-૫૦ કિગ્રા ☐ ૫૦-૫૪ કિગ્રા ☐ ૫૪-૫૮ કિગ્રા ☐ ૫૮-૬૨ કિગ્રા ☐ ૬૨-૬૬ કિગ્રા ☐ ૬૬-૭૦ કિગ્રા ☐ ૭૦-૭૪ કિગ્રા ☐ ૭૪-૭૮ કિગ્રા ☐ ૭૮-૮૨ કિગ્રા ☐ ૮૨ કિગ્રાથી ઉપર
	બહેનો	☐ ૩૨ કિગ્રા સુધી ☐ ૩૨-૩૬ કિગ્રા ☐ ૩૬-૪૦ કિગ્રા ☐ ૪૦-૪૪ કિગ્રા ☐ ૪૪-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૨ કિગ્રા ☐ ૫૨-૫૬ કિગ્રા ☐ ૫૬-૬૦ કિગ્રા ☐ ૬૦-૬૪ કિગ્રા ☐ ૬૪-૬૮ કિગ્રા ☐ ૬૮ થી ઉપર
રંગબી	☐ રંગબી	
❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖		
એથલેટીક્સ	☐ ૫૦૦૦મી ☐ ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ ☐ ૧૦૦ મી હર્ડલ્સ(બહેનો) ☐ ૪૦૦મી હર્ડલ્સ ☐ ૪ X ૧૦૦મી. રીલે ☐ ૪ X ૪૦૦ મી.રીલે ☐ વાંસદ્વદ ☐ હથોડા ફેંક	
સ્વીમીંગ	☐ ફ્રી સ્ટાઈલ ૫૦મી ☐ ફ્રી સ્ટાઈલ ૨૦૦મી ☐ ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો ☐ ફ્રીસ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ ☐ ફ્રીસ્ટાઈલ રીલે ૪ X ૧૦૦મી. ☐ બેસ્ટ સ્ટ્રોક ૫૦ મી ☐ બેક સ્ટ્રોક ૨૦૦ મી ☐ બટર ફ્લાય ૫૦મી ☐ બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી ☐ બેક સ્ટ્રોક ૫૦ મી ☐ બેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી ☐ મીડલે રીલે ૪ X ૧૦૦મી ☐ વ્યક્તિગત મીડલે ૪૦૦ મી	
	ભાઈઓ	☐ ૭૩ કિગ્રાથી ઉપર અને -૮૧ કિગ્રા સુધી ☐ ૮૧ કિગ્રાથી ઉપર અને -૯૦ કિગ્રા સુધી ☐ ૯૦ કિગ્રાથી ઉપર અને -૧૦૦ કિગ્રા સુધી ☐ ૧૦૦ કિગ્રાથી ઉપર
	બહેનો	☐ ૫૭ કિગ્રાથી ઉપર અને -૬૩ કિગ્રા સુધી ☐ ૬૩ કિગ્રાથી ઉપર અને -૭૦ કિગ્રા સુધી ☐ ૭૦ કિગ્રાથી ઉપર અને -૭૮ કિગ્રા સુધી ☐ ૭૮ કિગ્રાથી ઉપર
કુસ્તી	ભાઈઓ	☐ ૭૪-૭૮ કિગ્રા ☐ ૭૮-૮૬ કિગ્રા ☐ ૮૬-૯૨ કિગ્રા ☐ ૯૨-૯૭ કિગ્રા ☐ ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો	☐ ૫૬-૬૨ કિગ્રા ☐ ૬૨-૬૫ કિગ્રા ☐ ૬૫-૬૮ કિગ્રા ☐ ૬૮-૭૨ કિગ્રા ☐ ૭૨-૭૬ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ	☐ ૪૮-૫૧ કિગ્રા ☐ ૫૧-૫૫ કિગ્રા ☐ ૫૬-૬૩ કિગ્રા ☐ ૬૩-૬૮ કિગ્રા ☐ ૭૩-૭૮ કિગ્રા ☐ ૭૮ કિગ્રાથી ઉપર
	બહેનો	☐ ૪૦-૪૨ કિગ્રા ☐ ૪૨-૪૪ કિગ્રા ☐ ૪૪-૪૬ કિગ્રા ☐ ૪૬-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૨ કિગ્રા ☐ ૫૫-૫૬ કિગ્રા ☐ ૫૬-૬૩ કિગ્રા ☐ ૬૮ કિગ્રા થી ઉપર
આર્થરી	રીકવ રાઉન્ડ ☐ વ્યક્તિગત ઓવરઓલ ☐ વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ ☐ ટીમ ☐ મીક્સ ટીમ કમ્પાઉન્ડ રાઉન્ડ ☐ વ્યક્તિગત ઓવરઓલ ☐ વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ ☐ ટીમ ☐ મીક્સ ટીમ	➢ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે
જીમ્નાસ્ટીક	ભાઈઓ	☐ ફ્લોર એક્સાઈઝ ☐ વોલ્ટીંગ ટેબલ ☐ રોમનરીંગ ☐ પેરલલબાર ☐ પોમ્પેલહોર્સ ☐ હોરિજન્ટલબાર
	બહેનો	☐ ફ્લોર એક્સાઈઝ ☐ વોલ્ટીંગ ટેબલ ☐ બેલેસીંગબીમ ☐ અન ઈવનબાર ☐ ફૂપ(રિધમીક) ☐ ક્લબ(રિધમીક) ☐ બોલ(રિધમીક) ☐ રીબન (રિધમીક)
સ્કેટીંગ	સ્કોડ	☐ રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઈન લાઈન	☐ રોડ ૨ (૫૦૦ મી.) ☐ રોડ ૩ (૩૦૦૦ મી.)
સાઈકલીંગ	☐ ૨૦ કી.મી.	
શુટીંગ	રાઇફલ ગ્રુપ	☐ ૧૦ મી. એર રાઇફલ પીપ ☐ ૫૦ મી. ૦.૨૨ રાઇફલ ૩ પોઝિશન
	પિસ્તોલ ગ્રુપ	☐ ૧૦ મી. એર પિસ્તોલ ☐ ૦.૨૨ રેપીડ ફાયર (ભાઈઓ) ☐ ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
	ટ્રેપ ગ્રુપ	☐ શોટગન ટ્રેપ ☐ શોટગન ડબલ ટ્રેપ
વેઇટલીફ્ટીંગ	ભાઈઓ	☐ ૫૫ કિગ્રા ☐ ૬૧ કિગ્રા ☐ ૬૭ કિગ્રા ☐ ૭૩ કિગ્રા ☐ ૮૧ કિગ્રા ☐ ૮૬ કિગ્રા ☐ ૯૬ કિગ્રા ☐ ૧૦૨ કિગ્રા ☐ ૧૦૬ કિગ્રા ☐ ૧૦૯ કિગ્રા થી ઉપર
	બહેનો	☐ ૪૫ કિગ્રા ☐ ૪૯ કિગ્રા ☐ ૫૫ કિગ્રા ☐ ૫૯ કિગ્રા ☐ ૬૪ કિગ્રા ☐ ૭૧ કિગ્રા ☐ ૭૬ કિગ્રા ☐ ૮૧ કિગ્રા ☐ ૮૭ કિગ્રા ☐ ૮૭ કિગ્રા થી ઉપર
ફેન્સીંગ	☐ ફોઇલ ☐ ઈપી ☐ સેબર	
બોક્સીંગ	ભાઈઓ	☐ ૪૬-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૧ કિગ્રા ☐ ૫૧-૫૪ કિગ્રા ☐ ૫૪-૫૭ કિગ્રા ☐ ૫૭-૬૦ કિગ્રા ☐ ૬૦-૬૩.૫ કિગ્રા ☐ ૬૩.૫-૬૭ કિગ્રા ☐ ૬૭-૭૧ કિગ્રા ☐ ૭૧-૭૫ કિગ્રા ☐ ૭૫-૮૦ કિગ્રા ☐ ૮૦-૮૬ કિગ્રા ☐ ૮૬-૯૨ કિગ્રા ☐ ૯૨ થી ઉપર
	બહેનો	☐ ૪૫-૪૮ કિગ્રા ☐ ૪૮-૫૦ કિગ્રા ☐ ૫૦-૫૨ કિગ્રા ☐ ૫૨-૫૪ કિગ્રા ☐ ૫૪-૫૭ કિગ્રા ☐ ૫૭-૬૦ કિગ્રા ☐ ૬૦-૬૩ કિગ્રા ☐ ૬૩-૬૬ કિગ્રા ☐ ૬૬-૭૦ કિગ્રા ☐ ૭૦-૭૫ કિગ્રા ☐ ૭૫-૮૧ કિગ્રા ☐ ૮૧ થી ઉપર
બીચ હેન્ડબોલ	☐ બીચ હેન્ડબોલ	
બીચ વોલીબોલ	☐ બીચ વોલીબોલ	
ઘોડેસવારી	☐ જમ્પીંગ ☐ એન્ડયુરન્સ	
મલખંસ	☐ રોપ મલખંસ (ફક્ત બહેનો માટે) ☐ પોલ મલખંસ (ફક્ત ભાઈઓ માટે)	
સોકર ટેનીસ	☐ સીંગલ્સ ☐ ડબલ્સ	
સ્પોર્ટ્સ ક્લામીંગ	☐ લીડ ક્લામીંગ ☐ સ્પીડ ક્લામીંગ ☐ બોલ્ડરીંગ	
વુડબોલ	ફેરપ્લે	☐ સીંગલ્સ ☐ ડબલ્સ ☐ ટીમ
	સ્ટ્રોક	☐ સીંગલ્સ ☐ ડબલ્સ ☐ ટીમ

➢ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઇફલ લાવવાની રહેશે.
 ➢ બધી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF)ના નિયમો મુજબ યોજાશે
 ➢ શુટીંગ સ્પર્ધામાં રાઇફલ અથવા પિસ્તોલ અને ટ્રેપ ગ્રુપમાં કોઈપણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલ મહાકુંભ-૨૦૨૬

૪૦ વર્ષથી ઉપર (તા.૦૧/૦૪/૧૯૬૭ થી તા.૩૧/૦૩/૧૯૮૭ દરમ્યાન જન્મેલા)		
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે	☒	કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)
❖ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖		
રસ્સાખેંચ	☐ ભાઈઓ ૬૦૦ કિગ્રા ☐ બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)	
❖ સીધી તાલુકા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖		
ચેસ	☐ ચેસ	નોંધ:- અબોવ-૪૦ અને અબોવ-૬૦ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖		
શુટીંગ બોલ	☐ ફક્ત ભાઈઓ માટે	
બેડમીન્ટન	☐ સીંગલ્સ ☐ ડબલ્સ ☐ મિક્સ ડબલ્સ	
ટેબલ ટેનીસ	☐ સીંગલ્સ ☐ ડબલ્સ ☐ મિક્સ ડબલ્સ	
લોન ટેનીસ	☐ સીંગલ્સ ☐ ડબલ્સ ☐ મિક્સ ડબલ્સ	
સ્વીમીંગ	☐ ૫૦ મી.ફ્રી સ્ટાઈલ ☐ ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ ☐ ૫૦ મી બેક સ્ટ્રોક ☐ ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ☐ ૫૦મી.બટર ફ્લાય સ્ટ્રોક	
	સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.	

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)
 અબોવ-૪૦ માં માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે.
 ➢ આગળ જુકવાનું આસન:- પશ્ચિમોતાસન, ભુમાસન, ઉચિતપાદઆસન, કુર્માસન, યોગાસન
 ➢ પાછળ જુકવાનું આસન:- ચક્રાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન, ભુંજગાસન, સેતુબંધાસન
 ➢ કમળને વળાંક આપતું આસન:-પૂર્ણમત્સેન્દ્રઆસન, કમરમરોડાસન, વકાસન, ફાઇનું સમતુલન આસન, પગાનું સમતુલન આસન

❏ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏	
યોગાસન	☐ કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ

૬૦ વર્ષથી ઉપર (તા.૩૧/૦૩/૧૯૬૭ અને તે પહેલા જન્મેલા)	
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે	☒ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)
❏ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❏	
રસ્સાખેંચ	☐ ભાઈઓ ૬૪૦ કિગ્રા ☐ બહેનો ૫૦૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
❏ સીધી તાલુકા / ઝોન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❏	
ચેસ	☐ ચેસ
❏ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏	
બેડમીન્ટન	☐ સીંગલ્સ ☐ ડબ્લ્સ ☐ મિક્સ ડબ્લ્સ
ટેબલ ટેનીસ	☐ સીંગલ્સ ☐ ડબ્લ્સ ☐ મિક્સ ડબ્લ્સ
લોન ટેનીસ	☐ સીંગલ્સ ☐ ડબ્લ્સ ☐ મિક્સ ડબ્લ્સ
સ્વીમીંગ	☐ ૫૦ મી.ફી સ્ટાઈલ ☐ ૧૦૦ મી.ફી સ્ટાઈલ ☐ ૫૦ મી બેક સ્ટ્રોક
	☐ ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ☐ ૫૦ મી.બટર ફ્લાય સ્ટ્રોક
નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા) અબોવ-૬૦ માં માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. ૫ આસનો કરવાના રહેશે.આગળ જુકવાનું આસન,પાછળ જુકવાનું આસન,કમળને વળાંક આપતું આસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન સ્વીમીંગ રમતમાં કોઇપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.	
❏ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❏	
યોગાસન	☐ કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ